

RAN-2501001204060005/2501000104044072
S.Y.B.A. (Sem.-IV) Examination April - 2026
INTERNATIONAL ECONOMICS (SEC-IV)
Time: 1 Hour]
[Total Marks: 25

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુના અંક પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે. Figures to the right indicates full marks of the questions	Seat No.: Student's Signature
--	--

- પ્ર.1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો (કોઈપણ પાંચ) 10**
- 1) આંતરરાષ્ટ્રીય વેપાર નો અર્થ આપો.
 - 2) તુલનાત્મક ખર્ચ લાભ ના સિદ્ધાંત ની કોઈપણ પાંચ મર્યાદાઓ દર્શાવો.
 - 3) સાધન વિપુલતા એટલે શું?
 - 4) હેક્સર ઓલવીન ના સિદ્ધાંત ની ધારણાઓ જણાવો.
 - 5) ચલણ નું અવમૂલ્યન એટલે શું?
 - 6) વિનિમય દર નો અર્થ આપો.
 - 7) સમખરીદ શક્તિ ના સિદ્ધાંત નું હાર્દ દર્શાવો
- પ્ર.2. વેપારતુલા અને લેણદેણની તુલા એટલે શું? લેણદેણની તુલા ની અસમતુલા ના કરણો અને ઉપાયો ની ચર્ચા કરો 15**
- અથવા**
- પ્ર.2. અ) આંતરરાષ્ટ્રીય વેપાર થી થતાં લાભ સમજાવો. 08**
- બ) સમ ખરીદ શક્તિ ના સિદ્ધાંતનું સાપેક્ષ સ્વરૂપ ચર્ચો 07**
- અથવા**
- પ્ર.2. 1) તુલનાત્મક ખર્ચ લાભના સિદ્ધાંત ની ધારણાઓ સમજાવો. 05**
- 2) સમ ખરીદ શક્તિ ના સિદ્ધાંત ની મર્યાદાઓ સમજાવો (કોઈપણ પાંચ) 05**
- 3) નિરપેક્ષ ખર્ચ લાભ સિદ્ધાંત ની મર્યાદાઓ ચર્ચો 05**

ENGLISH VERSION

- Q.1. Answer the following question briefly (any five) 10**
- 1) Give the meaning of the International trade
 - 2) Indicate any five limitations of the principle of comparative cost benefit
 - 3) What is resource abundance ?
 - 4) State assumptions of the principle of Heckscher Ohlin
 - 5) What is devaluation of currency ?
 - 6) Give the meaning of exchange rate
 - 7) Indicates essence of purchasing power parity theory
- Q.2. What is balance of trade and balance of payments? Discuss causes and remedies of imbalance in balance of trade 15**
- OR**
- Q.2. a) Explain benefits of International trade 08**
- b) Discuss relative version of purchasing power parity theory 07**
- OR**
- Q.2. 1) Explain assumptions of the principle of comparative cost benefit 05**
- 2) Explain limitations of purchasing power parity theory (any five) 05**
- 3) Discuss limitations of absolute cost benefit theory 05**
-